



રાજકોટ મહાનગર સેવા સદન

ટાઉન પ્લાનીંગ શાખા,

"ડો. આંબેડકર ભવન", ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧.

વેબ સાઈટ : www.rmc.gov.in.

ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા સેન્ટ્રલ ઝોન કચેરી હેઠળના વિસ્તારના વોર્ડ નં.૩,૭,૧૩,૧૭ ના વિવિધ સ્થળ પર થયેલ દબાણ દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવેલ કુલ- (૮) સ્થળોએ થયેલ દબાણ દૂર કરી અંદાજે રૂ.૧૪.૫૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવેલ

તારીખ: ૨૩-૦૯-૨૦૨૧

મ્યુનિ. કમિશ્નર શ્રી અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફિસર શ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા. ૨૩/૯/૨૦૨૧ ના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં.૩,૭,૧૩,૧૭ ના વિવિધ સ્થળ પર થયેલ દબાણ દૂર કરવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવેલ. જે અન્વયે નીચેની વિગતે કુલ - (૮) સ્થળોએ થયેલ દબાણ દૂર કરી અંદાજે રૂ.૧૪.૫૦ કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવેલ છે.

ક્રમ	સ્થળ અંગેની વિગત	વોર્ડ	દબાણની વિગત, ખુલ્લી કરાયેલ જમીન તથા અંદાજિત કિંમત		
૧.	ટી.પી.-૧૯ રાજકોટ, એફ.પી.૪/બી, "ગાર્ડન" હેતુ, રેલનગર મેઈન રોડ	૩	ઓટા પ્રકારના મકાનોને લાગુ દબાણ દૂર કરાયેલ છે.	૬૬૬ ચો.મી	૩.૨૫ કરોડ
૨.	ટી.પી.સ્કીમ-૧૯ રાજકોટ, એફ.પી.૮/એ, "સોશિયલ ઇન્ફ્રા" હેતુ, આસ્થા ચોક પાસે, રામેશ્વરની બાજુમાં	૩	ધાર્મિક દબાણ તથા ઓટા પ્રકારના દબાણ દૂર કરાયેલ છે.	૨૩૦૪ ચો.મી.	૧૧.૨૫ કરોડ
૩.	ટી.પી.-૧૯ રાજકોટ રસ્તા પૈકીની જગ્યા, સંતોષીનગર ફાટક પાસે	૩	રસ્તાને નડતરરૂપ ધાર્મિક દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયેલ છે.		
૪.	લક્ષ્મીનગર આર.યુ.બી અન્ડર બ્રીજનાના એપ્રોચ પાસે	૭	અન્ડર બ્રીજનાના એપ્રોચને નડતરરૂપ ધાર્મિક દબાણ દૂર કરાયેલ છે.		
૫.	નવલનગર-૩ ના છેડે દ્વારકેશ પાર્ક પાસે	૧૩	માર્જીનની જગ્યામાં નડતરરૂપ દબાણ દૂર કરી માર્જીન-પાર્કીંગ ખુલ્લું કરાયેલ છે.		
૬.	હરિધવા માર્ગ પર પટેલ ચોક પાસે રામેશ્વર શેરી નં.૨	૧૭	ગેરકાયદેસર દીવાલ દૂર કરાયેલ છે.		
૭.	ભવાનીનગર શેરી નં.૪	૭	માર્જીનમાં થયેલ વધારાનું બાંધકામ દૂર કરાયેલ છે.		
૮.	ભારત હોઝીયરી, ધર્મેન્દ્ર રોડ,	૭	ઈમારતની અગાસી ઉપર કરવામાં આવેલ વધારાનું અનઅધિકૃત બાંધકામ દૂર કરાયેલ છે.		

આ ડિમોલિશનમાં ટાઉન પ્લાનીંગ શાખા સેન્ટ્રલ ઝોનના આસિ. ટાઉન પ્લાનર શ્રી પી. ડી. અઢીયા, આસિ. એન્જિનિયર શ્રી ઋષિ ચૌહાણ, શ્રી ઋષિકેશ ડાંગર, શ્રી જયદીપ ચૌધરી, એડીશ્નતલ આસિ. એન્જિનિયરશ્રી, શ્રી અજીત પરમાર તથા શ્રી પરાગ ટાંક, હેડ સર્વેયર શ્રી નીરવ વાણિયા તથા વર્ક આસી. શ્રી નીલકંઠરુદ્ર ચાવડા, શ્રી અમિત પરમાર સ્થળ પર હાજર રહેલ.

આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનની જગ્યા રોકાણ શાખાના ઇન્સ્પેક્ટરશ્રીઓ, રોશની, ફાયરબ્રિગેડ, તેમના સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહેલ. આ ડિમોલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાના અધિકારી સહ તમામ સ્ટાફ સાથે સ્થળ પર હાજર રહેલ.